

પ્રેસ નોંધ

કૃષિ મહાવિદ્યાલય-વ-કૃષિ પોલીટેકનીક, વસો ખાતે યોજાયેલ સાતમો વાર્ષિક દિન ઉજવણી કાર્યક્રમ
“વસોધરા-૨૦૧૯”

તારીખ ૧૨/૦૪/૨૦૧૯ ના રોજ કૃષિ મહાવિદ્યાલય-વ-કૃષિ પોલીટેકનીક , આણંદ કૃષિ યુનિવર્સિટી , વસો ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટી ના માનનીય કુલપતિ શ્રી એન.સી.પટેલ ના પ્રમુખપદે સાતમો વાર્ષિક દિન “વસોધરા-૨૦૧૯ “ઉજવણી નો કાર્યક્રમ યોજાઈ ગયેલ. આ વાર્ષિક દિન ની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા અને લોકપ્રિય એવા ગુજરાતી લેખક , કોલમીસ્ટ અને ભૂતપુર્વ વિદ્યાર્થી (બં.અ. કૃષિ મહાવિદ્યાલય) શ્રી દીપક સોલીયા તથા અતિથિ વિશેષ તરીકે આણંદ કૃષિ યુનિવર્સિટી ના સંશોધક નિયામક શ્રી ડો. કે.બી. કથીરિયા તથા યુનિવર્સિટી ના વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ ના નિયામક શ્રી ડો. એમ.એમ.ત્રિવેદી તથા ડીનશ્રી (કૃષિ) ડો. એમ.વી.પટેલ તથા ભૂતપુર્વ કુલપતિ શ્રી ડો. એ. એમ . શેખે હાજર રહી પ્રસંગ ને દિપાવ્યો હતો.

આ વાર્ષિક દિન ઉજવણી ના કાર્યક્રમમા વિવિધ સ્પર્ધાઓ જેવી કે એક મિનિટ , અંતાક્ષરી, ડમશેરાડ, ખાટ પે બાત, ટગ ઓફ વોર, સીનેમેજીક, સિંગીંગ, ડાન્સીંગ, વગેરે નુ આયોજન થયેલ જેમા બંને કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ એ ખુબ જ ઉત્સાહ થી ભાગ લીધેલ. ઉપરાંત વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓએ રંગોલી , ગરબા, સુશોભન ના કાર્યક્રમ મા પણ ખુબ જ રસપુર્વક ભાગ લીધેલ.

કાર્યક્રમ ની શરુઆત મા બંને કોલેજ ના આચાર્યશ્રી ડો.વાચ.એમ.શુક્લ એ આમંત્રિત મહાનુભાવો નો તથા સર્વે ઉપસ્થિત પ્રાધ્યાપક ગણ તથા વિદ્યાર્થી મિત્રો નો શાબ્દિક તથા પુષ્પગુચ્છ થી સ્વાગત કરેલ તેમજ વર્ષ દરમિયાન કોલેજ ના થયેલ વિકાસ ની ચર્ચા કરેલ. આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન વિવિધ રમત ગમત તથા સાંસ્કૃતિ પ્રવૃત્તિઓમા ભાગ લઈ વિજેતા બનનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ને મહાનુભાવો દ્વારા ઇનામ વિતરણ કરવામા આવેલ તથા મહાનુભાવો એ પોતના વ્યક્ત્ય દ્વારા ગ્રેજ્યુએશન પુર્ણ કરનાર બેચ ને ઉત્તમ કારકીર્દી માટે માર્ગદર્શન, આર્શીવચન તથા અભિનંદન પાઠવેલ.

કાર્યક્રમના અંત મા એસ.આર.સી. ચેરમેન શ્રી સહદેવ લુહારે કાર્યક્રમ ની સફળતા માટે લીધેલ ભારે જેહમત બદલ સૌનો હૃદયપુર્વક આભાર વ્યક્ત કરેલ અને રાષ્ટ્ર ગાન સાથે સાતમો વાર્ષિક દિન “વસોધરા-૨૦૧૯ “ ના ઉજવણી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ થયેલ.






